

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ-2011**

અભ્યાસક્રમ	: સ્ટોફિક્ટ ઈન યોગવિજ્ઞાન (CYS)	નોંધણી નંબર : _____
પાઠ્યક્રમ	: યોગપરિચ્ય-મહર્ષિ પતંજલિ યોગદર્શનમુ (CYS-01)	
તારીખ	: 20-04-2011	
સમય	: 11.00 to 2.00	
સૂચના	: (1) બધા જ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. (2) પ્રત્યેક પ્રશ્નની સામે ગુણ દર્શવેલ છે.	કુલ ગુણ : 70

પ્રશ્ન:-1	(અ) યોગની ત્રણ વ્યાખ્યા આપી એકની પરિભાષા સમજાવો.	(07)
	(બ) આધુનિકયુગમાં યોગની આવશ્યકતાના કારણો જાણાવો.	(07)
<b>અથવા</b>		
	(અ) શ્રીમદ ભગવદગીતામાં જણાવેલ યોગની યોગા જણાવી સમજાવો.	(07)
	(બ) હઠયોગ એટલે શું ? હઠયોગ પ્રદિપીકા તો માહિતી આપો.	(07)
પ્રશ્ન:-2	(અ) મહર્ષિ પતંજલિ યોગસૂત્રના દરેક પાઠની માહિતી આપો.	(07)
	(બ) 'કિયાયોગ' ની વ્યાખ્યા આપી વિષે સમજાવો.	(07)
<b>અથવા</b>		
	(અ) વર્તમાન સમયમાં યોગનું મહત્વ જણાવો.	(07)
	(બ) યોગ વિષે ભામક જ્ઞાનો અને તેનું ખંડન જણાવો.	(07)
પ્રશ્ન:-3	(અ) વ્યાયામ અને યોગવયેનો તફશિવત જણાવો.	(07)
	(બ) ખટકર્મ વિષે જણાવો અને ટૂંકમાં સમજાવો.	(07)
<b>અથવા</b>		
	(અ) ભાડિયાળા વિશિષ્ટતાઓ અને પ્રકાર જણાવો.	(07)
	(બ) કર્મયોગજીત સિદ્ધાંત જણાવી તેનું મહત્વ જણાવો.	(07)
પ્રશ્ન:-4	(અ) વિદીજની દેણિએ 'અનાસક્તિયોગ' વિષે જણાવો.	(07)
	(બ) અષ્ટાંગયોગનું છિંદું અંગ જણાવી મહત્વ સમજાવો.	(07)
<b>અથવા</b>		
	(અ) આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.	(07)
	(બ) માનસિક શાંતિ માટે પ્રાણાયામની ઉપયોગિતા લખો.	(07)
પ્રશ્ન:-5	ટૂંકનોંધ લખો (ગમે તે બે) (અ) સાંખ્યદર્શનના સિદ્ધાંતો (બ) કુંડલિનીયોગ (ક) બંધ અને મુદ્રા (દ) પ્રાણાયામ (અષ્ટ કુંભકો)	(14)

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ-2011**

**અભ્યાસક્રમ :** સટીફિકેટ ઈન યોગવિજ્ઞાન (CYS) **નોંધણી નંબર :** \_\_\_\_\_

**પાઠ્યક્રમ :** શરીર વિજ્ઞાન-માનસિક સ્વાસ્થ્ય (CYS-02)

**તારીખ :** 20-04-2011

**સમય :** 3.00 to 6.00

**સૂચના :** (1) બધા જ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે.  
(2) પ્રત્યેક પ્રશ્નની સામે ગુણ દર્શવેલ છે.

**કુલ ગુણ : 70**

---

- પ્રશ્ન:-1** મુદ્દાસર જવાબ લખો. (ગમે તે ત્રણ) (15)  
1. (અ) માનસિક સ્વાસ્થ્યમાં ધ્યાનનો ફળો  
(બ) ચાર પુરુષાર્થ વિશે જણાવો.  
2. (અ) હતાશ વ્યક્તિત્વના લક્ષણો જણાવો.  
(બ) કોલમેન અને હેડલીના મતાનુસાર ત્રણસ્થ સમજાવો.  
3. (અ) ઉત્સર્જન તંત્રમાં ભાગ લેતા અવ્યવહી યાદી બનાવી ટૂંકમાં સમજાવો.  
(બ) સાંઘાનું કાર્ય જણાવો.  
4. (અ) શુકપિંડ-અંડપિંડ વર્ણવો.  
(બ) આયુર્વેદ અનુસાર માનસિક સ્વાસ્થ્ય વર્ણવો.  
5. (અ) ચેતાતંત્રની રચનાને પ્રેરણીય આપો.  
(બ) પાર્થનાનું મહત્વ પમજાવો.
- પ્રશ્ન:-2** ટૂંકનોંધ લખો (ગમે તે ચાર) (20)  
1. રૂધિર  
2. ફેફસુલ  
3. લાગણાના લક્ષણ  
4. યોગિક પંચકોશ  
5. એટરોઈડ ગ્રંથિ
- પ્રશ્ન:-3** જવાબ લખો (ગમે તે દસ) (10)  
1. સ્નાયુઓના કેટલા પ્રકાર છે ? કયા કયા  
2. ટેસ્ટોસ્ટેરોનનું કાર્ય ટૂંકમાં જણાવો.  
3. હાડકાની આતરિક વૃદ્ધિ માટે કેવો આહાર જરૂરી છે?  
4. હદ્યની આંતરિક રચના ટૂંકમાં સમજાવો.  
5. શ્વાસનળીની રચના વર્ણવો.  
6. રંગસૂત્ર એટલે શું ? તેની અગત્યતા જણાવો.  
7. વ્યક્તિત્વ શબ્દનો અર્થ જણાવો.  
8. મનોમય કોશ વિશે લખો.  
9. ડર દૂર કરવા શું કરશો ?  
10. વ્યક્તિગત સમભાવ પ્રાર્થના એટલે શું ?  
11. ચાર પુરુષાર્થ સમજાવો.  
12. W.H.O મુજબ માનસિક સ્વાસ્થ્ય સમજાવો.

પ્રશ્ન:-4 ખાલી જગ્યા પૂરો. (કોઈપણ દસ) (10)

1. પિઘુટરી ગંથિને \_\_\_\_\_ પણ કહે છે.
2. હદ્યને રકત પૂરું પાડનાર \_\_\_\_\_ ધમની છે.
3. આધુનિક જીવનની સૌથી મોટી સમસ્યા \_\_\_\_\_ છે.
4. \_\_\_\_\_ એ યોગસાધના કરવા માટેનું આવશ્યક સાધન છે.
5. પ્રાણ એટલે \_\_\_\_\_ પ્રાણ.
6. પણ્ચિયમ મનોવિજ્ઞાન એ \_\_\_\_\_ વિજ્ઞાન પર આધારિત છે.
7. \_\_\_\_\_ માનસિક સ્વાસ્થ્યની ચાવી છે.
8. મનમાં ચાલતું દુઃખ એટલે \_\_\_\_\_
9. \_\_\_\_\_ માં સમત્વ વધતાં સુખ અને સંતુલન આવે છે.
10. Emotion આ શબ્દ લેટીન ભાષાના શબ્દ \_\_\_\_\_ પરથી આવ્યો છે.
11. કોઈપણ લાગણી \_\_\_\_\_ પર ખરાબ અસર ફરજ છે.
12. શરીર એટલે \_\_\_\_\_ સંરચના
13. ખોરાક ચાવવાનો શરૂ કરીએ ત્યારે \_\_\_\_\_ નું પાચન શરૂ થાય છે.
14. શ્વેતકણો રકતકણો કરતાં કદમાં \_\_\_\_\_ હાય છે.
15. સ્વાદુપિંડમાં કોષપૂંજો \_\_\_\_\_ નાના વિચાનિકે શોધેલા હતા.

પ્રશ્ન:-5 (અ) નીચેના વાક્યો ખરા છે કે ખોટા જણાવો. (10)

1. રૂધિરનું શુદ્ધિકરણ ફેફસામાં થાય છે.
2. શરીરમાં કુલ ચાર મૂત્રપિંડ આપવા છે.
3. હદ્યની આંતરિક રચનામાં ચાર ખાના છે.
4. ચેતાતંત્રનો મૂળભૂત એક \_\_\_\_\_ ગંગ છે.
5. થાઈરોઇડ ગંથિ મુગામાં દર ગોઠવાયેલ છે.
6. તનાવ દૂર કરવા ઉયાત આવશ્યક છે.
7. રૂધિરમાં રહેલા રૂત કણો રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.
8. મોટું આંતરકુલાયામાં નાના આંતરડા કરતા મોટું છે.
9. સાખ્યદર્શાના રચયિતા સુખદેવ મુનિ હતા.
10. પ્રાર્થનાનું મૂળ દયા છે.

(બ) જોડકા જીંદગી (05)

કિંદ્યુટરી	કોટીસોન
સ્વાદુપિંડ	રૂધિર
શુકપિંડ	ગલુકેગોન
એઝ્રિનલ	ગોથ હોર્મોન
હદ્ય	ટેસ્ટોરસ્ટેરોન

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ-2011**

અભ્યાસક્રમ : સટીફિકેટ ઈન યોગવિજ્ઞાન (CYS)  
 નોંધણી નંબર : \_\_\_\_\_

પાઠ્યક્રમ : અષ્ટાંગ યોગ—સ્વસ્થ જીવનચર્ચ (CYS-03)

તારીખ : 23-04-2011

સમય : 11.00 to 2.00

સૂચના : (1) બધા જ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે.  
 (2) પ્રત્યેક પ્રશ્નની સામે તેનાં ગુણ દર્શાવેલ છે.

કુલ ગુણ : 70

- પ્રશ્ન:-1 ખાતી જગ્યા પૂરો.** (10)
1. \_\_\_\_\_ એ જીવન શાસ્ત્ર છે.
  2. એલોપેથી \_\_\_\_\_ નું શાસ્ત્ર છે.
  3. કુદરતી આરોગ્ય મળવાનું \_\_\_\_\_ કરી શકે છે.
  4. \_\_\_\_\_ નો રોગ અનેક રોગોનું મળ કહેવાય છે.
  5. \_\_\_\_\_ પ્રકૃતિવાળાને વધારે ઉંઘ આવે છે.
  6. \_\_\_\_\_ અસ્તુમાં દિવસે સંકુ જોઈએ.
  7. \_\_\_\_\_ દિશાઓમાં અસ્તુ રાખીને સુવું જોઈએ.
  8. \_\_\_\_\_ અસ્તુમાં દિવસે સુવું જોઈએ.
  9. \_\_\_\_\_ પ્રકૃતિવાળાને ઓછી ઉંઘ આવે છે?
  10. \_\_\_\_\_ નું પાત્રી પીવાથી શરીરને નુકશાન થાય છે.
- પ્રશ્ન:-2 નીચેના વાક્યો ખરાં મેળે જોયા તે નિશાની દ્વારા જણાવો.** (10)
1. શરદમાં પિત્રો પ્રકાપ થાય છે.
  2. શરદમાં તાપમાં વધુ ફરવું જોઈએ.
  3. શરદમાં ચાંદનીની શીતળતામાં ધૂમવું.
  4. વર્ષામાં જઠરાણિન વધુ પ્રદીપ થાય છે.
  5. વર્ષામાં દહી, શીખંડ ખાવા જોઈએ.
  6. વસંતઅસ્તુમાં દિવસે સુવું જોઈએ.
  7. વ્યાયામ વર્ષામાં વધુ ન કરવો.
  8. વસંતમાં લૂંખો અને ગરમ આહાર લેવો.
  9. વર્ષામાં વાયુ કરનારો ખોરાક ન લેવો.
  10. શ્રાવણમાસ કે ચર્તુમાસમાં એકટાણા કરવા દીર્ઘનીય નથી.
- પ્રશ્ન:-3 ટૂંકનોંધ (કોઈ પણ ચાર)** (20)
1. વિવિધ સ્નાન
  2. સ્વર્ચષ્ટતા
  3. પ્રાર્થનાના પ્રકાર
  4. ઉપવાસ
  5. દિનચર્ચા
  6. વિરુદ્ધ આહાર

પ્રશ્ન:-4	મુદ્દાસર જવાબ આપો. (કોઈ પણ ત્રણ)	(06)
	1. ધાંતણ માટે વપરાતી કઈ કઈ વનસ્પતિ છે. 2. વહેલા જાગવાના ફાયદા. 3. દૂધ ગુણકારી છે ? 4. સ્વાસ્થ્યની આયુર્વેદની વ્યાખ્યા.	
પ્રશ્ન:-5	એક લીટીમાં જવાબ આપો. (કોઈ પણ ચાર)	(04)
	1. કોષ આવવાનું કારણ શું ? 2. તાવ આવે એટલે શું ? 3. અસ્તુઓ કેટલી ? 4. અતિને ગતિ નહી રાયુ ? 5. બિમાર વ્યક્તિને કયો કઠોળ આપી શકાય ?	
પ્રશ્ન:-6	નીચેનામાંથી કોઈપણ પાંચના જવાબ આપો મુદ્દાસર	(15)
	1. હેમન્તમાં કેવો આહાર લેશો. 2. શ્રીજમ ચર્ચાનું વર્ણન કરો. 3. સ્નાનના ફાયદા 4. અજમો કયા રોગમાં ફાયદા કારક છે. 5. શુક્રરક્ષાનું મહત્વ સમજાવો. 6. માતાના દૂધના ગુણવિભિન્ન લખો. 7. કેવો રોગી દિવસે ન સૂઈ શકે.	
પ્રશ્ન:-7	જોડકાં જોડો	(05)
	(1) વસંત અસ્તુ (1) મગ (2) શિશિર અસ્તુ (2) અખાઢશાવણ (3) શરદઅસ્તુ (3) વાત (વાયુ) (4) કઠોળમાં શ્રેષ્ઠ (4) પિત (5) વર્ષાઅસ્તુ (5) કષ	

www.StudyGuideIndia.com

---